



FORT BEND COUNTY COURTS

ભાષા સહાયતા સેવાઓની વિનંતી કેવી રીતે કરવી

કોર્ટની ભાષા સહાયતા નીતિ - જો કોઈ ઠાવેદાર, પક્ષકાર, અસીલ, સાક્ષી અથવા કોર્ટની કાર્યવાહી સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિને કોર્ટની સુનાવણી દરમિયાન અંગ્રેજી ભાષામાં વાતચીત કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા અંગ્રેજીમાં અનુવાદિત દસ્તાવેજની જરૂર હોય, તો વકીલ અથવા મર્યાદિત અંગ્રેજી પ્રાવીણ્ય (LEP) વ્યક્તિએ દુભાષીયા અથવા અનુવાદ સેવાઓ માટે લેખિત વિનંતી કરવી આવશ્યક છે. જો જરૂરી હોય તો, વિનંતી ફોર્મ ભરવામાં સહાયતા ઉપલબ્ધ છે. કોર્ટ તમામ કોર્ટ કાર્યવાહીમાં અર્થઘટન અથવા અનુવાદ સેવાઓ સાથે સંકળાયેલા તમામ ખર્ચને આવરી લેશે.

દુભાષીયા સેવા વિનંતી ફોર્મ કાઉન્ટી કોર્ટના વેબપેજ www.fbctx.gov/languageaccess પર ઉપલબ્ધ છે. દરેક કોર્ટરૂમમાં અને પહેલા માળ પર સ્થિત જસ્ટિસ સેન્ટર ઇન્ફર્મેશન ડેસ્ક પર પણ મુદ્રિત નકલો ઉપલબ્ધ છે.

પૂર્ણ કરેલ ફોર્મ કોર્ટના સંયોજક અથવા ભાષા એક્સેસ નિયામકને સબમિટ કરવું આવશ્યક છે કોઈપણ રજૂઆત, સુનાવણી અથવા ટ્રાયલના ઓછામાં ઓછા 72 કલાક પહેલા જેમાં સલાહકાર નીચેની નવ ભાષાઓમાંથી એકમાં ભાષાના દુભાષીયાની જરૂરિયાતની વ્યાજબી અપેક્ષા રાખે છે:

સ્પેનિશ
વિયેતનામીસ
યાઇનીઝ

ઉર્દુ
મલયાલમ
ટાગાલોગ

ગુજરાતી
હિન્દી
અરબી

કાઉન્સેલ અથવા વ્યક્તિઓ જે પોતાનું પ્રતિનિધિત્વ કરે છે તેઓએ અન્ય કોઈપણ ભાષામાં ભાષા દુભાષીયા સેવાઓની જરૂરિયાત માટે ચૌદ (14) દિવસની સૂચના આપવી જોઈએ. કાયદા અથવા જિલ્લા અદાલતોમાં કાઉન્ટી કોર્ટમાં સેવા આપતા તમામ દુભાષીયાઓ માસ્ટર લાઇસન્સ ધરાવતા પ્રમાણિત કોર્ટના દુભાષીયા હોવા આવશ્યક છે, સિવાય કે કાનૂન દ્વારા નિર્દિષ્ટ કરેલ હોય.

અમુક કિસ્સામાં આ સમયમર્યાદામાં અપવાદો ન્યાયાધીશની વિવેકબુદ્ધિથી કરવામાં આવી શકે છે. આ સમયરેખાઓનું અવલોકન સક્ષમ અને લાઇસન્સ પ્રાપ્ત દુભાષીયા શોધવામાં મદદ કરે છે.

વિનંતી ફોર્મને પૂર્ણ કરવા અને તેને કોર્ટના સંયોજકને, વ્યક્તિગત રૂપે અથવા ઇમેઇલ દ્વારા પરત કરવાની એટર્ની અથવા LEP વ્યક્તિની જવાબદારી. **દુભાષીયા સેવા અથવા અનુવાદ સેવાઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને 281-633-7658 પર કૉલ કરો અથવા અમને અહીં ઇમેઇલ કરો: languageaccess@fbctx.gov.**